

દેણદારની સંમતિ અને ઘોષણાઓ
(જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ લોન માટે અરજી)

દેણદારનું નામ

લોનનો પ્રકાર: જોઈન્ટ લેબિલિટી લોન

લાગુ કરેલ લોનની રકમ: INR.....

વ્યાજ દર. ગ્રાહકના રિસ્ક પ્રોફાઇલિંગ પર આધાર રાખીને રિડ્યુસિંગ બેલેન્સ પર વાર્ષિક 23% થી 25% વ્યાજ દર લાગુ કરવામાં આવે છે.

ઘોષણા:

1. હું આ સાથે ઘોષિત કરું છું, સ્વીકારું છું અને સમજું છું કે:

- a) અરજીમાં આપેલ આવક અને ખર્ચ સહિતની આપવામાં આવેલ તમામ જાણકારી તમામ રીતે સત્ય, સાચી અને સંપૂર્ણ છે અને આરબીએલ બેંક લિમિટેડ સામે કોઈ મટિરીયલ જાણકારી રોકવામાં/દબાવવામાં નથી આવી. હું મંજૂર કરું છું કે સીધા જ અથવા કોઈ તૃતીય-પક્ષ એજન્ટ દ્વારા બેંક આ ખરાઈ કરાવવાનો અધિકાર ધરાવે છે. મારા દ્વારા આવશ્યક નાણાંકીય સહાયના સંબંધમાં જ્યારે જરૂર હોય ત્યારે આવું અતિરિક્ત લેખન મારા દ્વારા આપવામાં આવશે. કોઈપણ સુવિધા જે બેંક મને આપવાનું નક્કી કરે તે, તેમની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર આધીન રહેશે મને મળનારી સુવિધા(ઓ)ના નિયમો અને શરતોથી હું બંધાયેલો/બંધનકર્તા રહીશ.
- b) આ સાથે હું આરબીએલ બેંકને યુઆઈડીએઆઈ પાસેથી મારી વ્યક્તિગત વિગતો લાવવાનો અને યુઆઈડીએઆઈ તરફથી ડેમોગ્રાફિક અને અંગત જાણકારી લાવવાના હેતુથી મારા આધાર નંબર/વીઆઈડી નંબર, બાયોમેટ્રિક જાણકારી અને/અથવા વન ટાઈમ પિન(ઓટીપી) ડેટા (અને/અથવા કોઈપણ સમાન અધિકૃતતા ડેટા) પૂરો પાડવામાં સંમતિ આપું છું અને અધિકૃતતા આપું છું.
- c) હું રાજનૈતિક રીતે પ્રગટ થયેલી વ્યક્તિ નથી/રાજનૈતિક રીતે પ્રગટ થયેલ વ્યક્તિ સાથે સંકળાયેલ નથી.
- d) હું આ સાથે ઘોષિત કરું છું કે 'નીચે'આપ્યા અનુસાર ખાતા માટે હું ફક્ત એક સહી રાખવા ઇચ્છું છું. ઉપરાંત, ખાતાની કામગીરી માટે, હું કોઈ અન્ય રીતે સહી કરીશ નહીં અને બેંકને સૂચના આપું છું કે મારા દ્વારા ફાળવવામાં/આપવામાં આવેલ તમામ સાધન/સૂચનાઓનો સ્વીકાર કરે અને તેનું માન રાખે.
- e) હું આ સાથે બેંકને આ પ્રમાણે ડિસ્ક્લોઝર માટે અધિકૃતતા આપું છું; (i) મારા સંબંધિત જાણકારી અને ડેટા; (ii) મારા દ્વારા લેવાયેલ કે/લેવાનાર કોઈ પણ કેડિટ સુવિધા સાથે સંબંધિત જાણકારી અને ડેટા માટે, અને (iii) મારી જવાબદારીઓ પૂરી કરવામાં, મારા દ્વારા, જો કોઈ ડિફોલ્ટ હોય તો, બેંકને યોગ્ય અને જરૂરી લાગે તેમ, કેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો લિમિટેડ અથવા આના વતી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અધિકૃત કરવામાં આવેલ અન્ય કોઈપણ એજન્સી
- f) આરબીએલ બેંક આ અરજી સાથે જમા કરેલ ફોટોગ્રાફ અને દસ્તાવેજ પોતાની પાસે રાખવાનો અધિકાર ધરાવે છે અને તે વિવેકબુદ્ધિ પર કરવામાં આવશે નહીં. હું/ સમજું છું કે આ લોનની મંજૂરી આરબીએલ બેંકની મુનસફીને અને મારા દ્વારા આરબીએલ બેંક દ્વારા જરૂરી આવશ્યક દસ્તાવેજો અને અન્ય ઔપચારિકતા પૂરી કરવાને આધીન છે.
- g) જો મારું વર્તમાન આરબીએલ બચત ખાતું નિષ્ક્રિય/ ડોર્મન્ટ છે, તો હું મારું બચત ખાતું સક્રિય કરવા માટે સંમત થાઉં છું.
હા ☐ ના ☐
- h) પી.એ.એન ની ઘોષણા: ☐ હું પરમાનેન્ટ ખાતા નંબર ધરાવતો/ધરાવતી નથી અને મારી/અમારી અંદાજિત કુલ આવક (જીવનસાથીની આવક, સગીર, બાળક સહિત) વગેરે ઈન્કમેટેક્સ એક્ટ, 1961ની કલમ 64) અનુસાર, ઈન્કમેટેક્સ એક્ટ 1961("એક્ટ")ની જોગવાઈ અનુસાર ગણવામાં આવતા લઘુત્તમ ટેક્સને પાત્ર આવક કરતાં ઓછી થશે. (ફોર્મ 60 ડિક્લેરેશન ભરવાપાત્ર છે એવી વ્યક્તિ દ્વારા જે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ધરાવતા નથી).

સ્વીકૃતિ (ભરીને સભ્યને આપવાપાત્ર)

મારા/અમારા દ્વારા જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ લોન અંતર્ગત (તારીખ) રોજ રૂ.લોનની અરજી મળ્યાની પુષ્ટિ કરવામાં આવે છે જે ઘટકના અને બિડાણ (જો કોઈ હોય તો) ની પુષ્ટિને આધીન છે. આરબીએલ બેંક દ્વારા સમયે સમયે આવશ્યક અને તમારા દ્વારા આરબીએલ બેંકને આપવામાં આવતા દસ્તાવેજ/જાણકારી મળ્યાના 15 દિવસની અંદર સામાન્ય રીતે તમારી અરજીની સ્થિતિ વિશે બેંક તમને જાણ કરવાનો પ્રયત્ન કરશે.

(વ્યાપાર સંવાદતાનું નામ/
બેંક પ્રતિનિધિનું નામ)

(સહી)

(ઈએમપી ઓળખપત્ર)

ગ્રાહક સેવા (24x7): +91 22 61846300 | ઈમેલ આઈડી: customercare@rbl.bank.in | વેબસાઈટ: www.rbl.bank.in

i) હું કોઈ બેંકનો ડિરેક્ટર છું* ☐ હા ☐ ના

બેંકનું નામ: _____

હું આરબીએલ બેંક/અન્ય બેંક* /આરબીએલ બેંકના વરિષ્ઠ અધિકારીનો અંગત સ્વજન છું ☐ હા ☐ ના

હું આરબીએલ બેંકનો વરિષ્ઠ અધિકારી છું ☐ હા ☐ ના

ડિરેક્ટર/ડિરેક્ટરના અંગત સ્વજન ભાગીદાર/ગેરંટર/રસ ધરાવતી પાર્ટી/કર્મચારી હોય તેવા કોઈ એકમનો હું હિસ્સો છું અથવા આરબીએલ બેંકના ડિરેક્ટર મારી કોઈપણ કેડિટ સુવિધાના ગેરંટર છે: ☐ હા ☐ ના

*શેડ્યુલ્ડ સહકારી બેંકો/ડિરેક્ટર, સબસિડીઅરીના ડિરેક્ટર/મ્યુચ્યુઅલ ફંડ/વેન્યુર કેપિટલ ફંડના ટ્રસ્ટીઓ સહિત.

જો હા, તો નીચે વિગતો જણાવો: મારા દ્વારા ઘોષિત કરવામાં આવે છે કે હું આરબીએલ બેંકના અથવા અહીં નિયત કરેલ કોઈ ખાસ બેંકના ડિરેક્ટર(ડિરેક્ટરો) અને/અથવા વરિષ્ઠ અધિકારી(ઓ) સાથે સંબંધ ધરાવું છું.

ક્રમાંક નં.	ડિરેક્ટર(ડિરેક્ટરો)/વરિષ્ઠ અધિકારી(ઓ)નું નામ	હોદ્દો	સંબંધ

ધરેલુ આવકના મૂલ્યાંકન માટે ઘોષણા: “મારા/અમારા દ્વારા આરબીએલ બેંકને મને/અમને નોટિસ આપ્યા વગર, મારા/અમારા દ્વારા અરજી પત્ર(પત્રો)માં/અરજદાર દ્વારા આરબીએલ બેંકને અરજી કરવામાં આવેલી લોનના સંદર્ભમાં એક્ઝીક્યુટ કરેલ દસ્તાવેજોમાં આપવામાં આવેલી જાણકારી, કેડિટ બ્યૂરો અને નિયમનકારી સત્તાઓ સમક્ષ પ્રગટ કરવાની અધિકૃતતા અને સંમતિ આપવામાં આવે છે. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે આવક અને ખર્ચની વિગતો સહિત, અરજી ફોર્મમાં આપવામાં આવેલ તમામ વિગતો અને જાણકારી સાચી, સત્ય અને સંપૂર્ણ છે અને આરબીએલ બેંક સામે કોઈ ભૌતિક જાણકારી મોકલક/છૂપાઈને રાખવામાં આવી નથી

આવશ્યક	પરિવારના સદસ્ય 1	પરિવારના સદસ્ય 2	પરિવારના સદસ્ય 3	પરિવારના સદસ્ય 4
નામ				
લેણદાર સાથે સંબંધ				
સહી / અંગૂઠાની છાપ				

અરજદારની સહી/અંગૂઠાની છાપ
તારીખ: દિવસ/મહિનો/વર્ષ

સભ્યના ડાબા/જમણા હાથના અંગૂઠાની છાપ:

LO નામ:

LO કર્મચારી ID:

LO સહી:

નોંધ:

- પૂર્વ-ચૂકવણી ચાર્જ: શૂન્ય
- વિલંબિત ચૂકવણીના કિસ્સામાં પેનલ ચાર્જ: શૂન્ય
- આરબીએલ બેંક નિર્દિષ્ટ વ્યાજ, પ્રોસેસિંગ ફી (જો કોઈ છે) અને વીમા પ્રીમિયમ (જો વીમા માટે અરજી કરેલ હોય તો) અને તમારી લોનની રકમ પર લાગુ જીએસટી સિવાય કોઈપણ વધારાની રકમ વસૂલશે નહીં.
- આર બી એલ માત્ર 1600xx (લેણદેન/સેવા) અને 140xx (પ્રચારાત્મક) નંબર પરથી કોલ કરે છે. ઓટીપી/પ્રમાણપત્ર કોઈ સાથે શેર ન કરો



લેણદાર સંમતિ અને ઘોષણાઓ
(બચત ખાતા માટે અરજી)



હું < _____ અરજદારનું નામ _____ > આરબીએલ બેંક તરફથી નીચેની સેવાઓ માટે વિનંતી કરું છું.

ઘોષણા

- આથી, બેંકને મારું આરબીએલ બચત ખાતું ખોલવા માટે અધિકૃત કરો, 'સિંગલ' મોડ ઓફ ઓપરેશન સાથે નજીકની આરબીએલ બેંક શાખામાં.
- મૂળભૂત આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ) માટે હું આરબીએલ બેંકને મારું ખાતું એકાઉન્ટ શક્ય બનાવવા માટે અધિકૃતતા આપું છું.
- હું આરબીએલ બેંકને ઈ-કેવાયસી માધ્યમ દ્વારા જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ લોન અરજી ફોર્મમાં પૂરી પાડવામાં આવેલ મારી કેવાયસી વિગતો ધ્યાનમાં લેવાની અધિકૃતતા આપું છું.
- હું બેંકની પાસબુકની ફાળવણીની ના પાડવા માટે મંજૂરી આપું છું અને સમજું છું કે પાસબુક અપડેટના બદલે, કોઈપણ ચાર્જ શુલ્ક વગર બીસી શાખાઓ પરથી ખાતા સ્ટેટમેન્ટ મેળવી શકાય છે.

આધાર સીડીંગ/લિંકીંગ અને ડીબીટી લાભ પ્રાપ્તિ સંમતિ: હું આ સાથે, સીધો લાભ પ્રાપ્ત કરવા માટે મારા બચત ખાતા સાથે આધાર લિંકીંગ/સીડીંગની અધિકૃતતા આપું છું અને મારો આધાર નંબર જમા કરાવું છું અને સ્વૈચ્છિક રીતે મારી સંમતિ આ હેતુઓથી આપું છું: (એ) યુઆઈડીએઆઈ તરફથી મને અધિકૃત કરવા માટે મારી આધાર વિગતોના ઉપયોગ માટે; (બી) મને એસએમએસ ચેતવણીઓ મોકલવા માટે મારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવા માટે; (સી) મારા તમામ વર્તમાન/નવા/ભાવિ આરબીએલ ખાતા/સીઆઈએફ સાથે આધાર નંબર લિંક કરવા માટે; (ડી) અરજી ફોર્મમાં આપવામાં આવેલ નોંધાયેલ મોબાઈલ નંબર પર એસએમએસ/ઈ-મેઈલ દ્વારા સીકેવાયસી રજીસ્ટ્રી તરફથી જાણકારી મેળવવા અને અપલોડ કરવા માટે.

આધાર નંબર સીડીંગ અને ડીબીટી લાભ મેળવવા માટેનો વિકલ્પ: (એક પર ટીક કરો):

- ☐ મારો આધાર નંબર કોઈપણ બેંક સાથે લિંક થયેલો નથી: હું મારો આધાર નંબર મારા બેંક ખાતા સાથે સીડ કરવા અને એનપીસીઆઈ મેપર સાથે ઈચ્છું છું જેથી મારા આરબીએલ બેંક ખાતામાં ભારત સરકાર તરફથી એલપીજી સબસિડી સહિત ડિબીટી મેળવવાનું મારા માટે શક્ય બને. હું સમજું છું કે જો એક કરતાં વધારે લાભ ટ્રાન્સફર મારા માટે બાકી હોય તો, હું તમામ લાભ ટ્રાન્સફર સમાન ખાતામાં મેળવીશ.
 - ☐ મારો આધાર નંબર પહેલેથી જ બીજી બેંક સાથે લિંક થયેલો છે: હું પહેલેથી આઈઆઈએન નંબર*** _____ ધરાવતી અને ભારત સરકાર તરફથી ડીબીટી મેળવવા માટે એનપીસીઆઈ સાથે સીડ થયેલ _____ (બેંકનું નામ) સાથે મારું ખાતું ધરાવું છું. હું મારા બેંક ખાતા સાથે મારું ડીબીટી લાભ ખાતુ(એનપીસીઆઈ મેપિંગ) તમારી બેંક સાથે બદલવાની વિનંતી કરું છું.
 - ☐ હું/અમે મારો/અમારો આધાર નંબર આરબીએલ બેંક સાથે લિંક કરવા ઈચ્છતા નથી.
- ***આઈઆઈએન(ઈશ્યૂઅર આઈડેન્ટિફિકેશન નંબર)

સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો:

- લાગૂ પડતી મર્યાદાને આધારે અને ઓળખ દસ્તાવેજો સાથે રાખીને ઉપાડની સ્લિપ ઉપયોગ કરીને બચત ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી છે (લાગૂ પડતી મર્યાદાને આધીન).
- બેંક દ્વારા સમયે સમયે ઘોષિત કરવામાં આવતા દરો પર દૈનિક બંધ/રોજના કલોઝિંગ બેલેન્સ પર બચત ખાતામાં વ્યાજ દર ત્રણ મહિને આપવામાં આવે છે. બચત ખાતાના વ્યાજ દરોમાં સુધારા વિશે બેંક દ્વારા એસએમએસ/ઈ-મેઈલ/અથવા બેંકને યોગ્ય લાગે તે રીતે ગ્રાહકોને જાણ કરવામાં આવશે. સૌથી તાજેતરના વ્યાજદરો જાણવા માટે જુઓ: www.rbl.bank.in.
- તમામ ભૌતિક ડિલીવરેબલ્સ 'પસંદગીના મેઈલિંગ સરનામે' અને ડિજિટલ ડિલીવરેબલ્સ હાલના નોંધાયેલ ઈ-મેઈલ આઈડી અથવા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
- નીચેની સેવાઓ માટેના બેંકના ચાર્જ વેબસાઈટ પર આપેલ ચાર્જના સમયપત્રક અનુસાર અને શાખાના નોટિસ બોર્ડ પર આપેલ ચાર્જ અનુસાર લાગૂ પડશે.
- બેંકના ખાતામાં રહેલ ડિપોઝીટ્સ સમયે સમયે નિયત નિયમો અનુસારની રકમ માટે ડીઆઈસીજીસી સાથે આરક્ષિત છે ડિપોઝીટ પર ઈન્થ્યોરન્સની વિગતો માટે લોગ ઓન કરો: www.dicgc.org.in
- ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે બેંકની વેબસાઈટ www.rbl.bank.in પર 'કસ્ટમર સર્વિસીઝ' અંતર્ગત બેંકની ફરિયાદ નિવારણ નીતિ જોઈ શકાય છે. તમારી ફરિયાદ નોંધાવવા માટે, તમારી નજીકની શાખાનો સંપર્ક કરો અથવા બેંકની વેબસાઈટ: www.rbl.bank.in પર કસ્ટમર સર્વિસીઝમાં લોગઈન કરો અથવા 91 22 61846300 પર કોલ કરો. ચૂકવવામાં આવેલ વ્યાજ લાગૂ પડતા દરે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ)ને આધીન છે. ઈન્કમેટેક્સના કાયદા અનુસાર પાન નંબર સિવાયની અરજીઓ પર વધુ ટીડીએસ કપાશે. વિગતવાર નિયમો અને શરતો માટે જુઓ, www.rbl.bank.in >>અન્ય>>સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

અરજદારની સહી/અંગૂઠાની છાપ
તારીખ: દિવસ/મહિનો/વર્ષ

સભ્યના ડાબા/જમણા હાથના અંગૂઠાની છાપ:

LO નામ:

LO કર્મચારી ID:

LO સહી: